

ગાંધીનગરના અપક્ષ ઉમેદવાર રાહુલ ચીમનભાઈ મહેતા



ઉંમર : ૪૦ વર્ષ; B Tech, Computer Sci, IIT Delhi, MS, Comp Sci, Rutgers Univ, USA

૧૭

રાહુલ ચીમનભાઈ મહેતા
(અપક્ષ)



અમે - રાઈટ ટુ રિકોલ પક્ષ - ની સ્થાપના કરીશું

- ૧. MRCM :** ખનીજોની રોચાલ્ટી, સરકારી જમીનનું ભાડુ (દા.ત. મેનેજમેન્ટ વસ્ત્રાપુર પ્લોટનું ભાડુ, એરપોર્ટના પ્લોટનું ભાડુ) સીધું જ નાગરીકો, સેનાને મળે, તેવો કાયદો બનાવવો. દા.ત. માનો ખનિજ રોચાલ્ટી, સરકારી જમીનનું ભાડુ ૧૯૯૫-૨૦૦૮માં રૂ ૪૫૦૦૦ કરોડ આવ્યું. તો રૂ ૧૫૦૦૦ કરોડ સેનાને અને આશરે રૂ ૩૦૦ દરેક નાગરીકના પોસ્ટ, બેંક ખાતામાં આપવા. આથી સૈન્ય શક્તિ વધશે, ત્રાસવાદ ઘટશે, ગરીબી ઘટશે. અનાજ, કઠોળ, દવાઓનાં ભાવ અનેક ગણા થયા છે, ગરીબોની આવક એટલી વધી નથી. આથી ગરીબી વધી છે. દા. ત. ૧૯૯૧માં માથાદીઠ કઠોળની ખપત કરતાં આજે ૨૦ ટકા ઓછી છે. જો ગરીબી નહીં ઘટે, તો ગરીબ હિન્દુઓ ખ્રિસ્તી અથવા નકસલવાદી થયા જશે. હિન્દુ ધર્મ ઘટશે. આથી સાચા હિન્દુવાદીઓને વિનંતી કે તેઓ સરકારી જમીનનું ભાડુ નાગરીકોને આપવાના કાયદાને ટેકો આપે, જેથી ગરીબ હિન્દુઓ ખ્રિસ્તી, નકસલવાદી ન બને.
- ૨. રાઈટ ટુ રિકોલ :** એટલે પાછા બોલાવાની સત્તા. નાગરીકો પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, તમામ ન્યાયાધીશો, પોલીસ ચીફ, શિક્ષણ અધિકારી, સિવિલ બેંક ગવર્નરને સીધા જ બદલી શકે (વર્ષો રાહ જોયા વિના), તેવા કાયદાઓ બનાવા. આથી સરકાર, કોર્ટોમાં ભ્રષ્ટાચાર ઘટશે. અને નાગરીકો અધિકારીની બદલી અટકવી શકે તેવા કાયદાઓ બનાવવા, જેથી અધિકારીઓ મંત્રીઓના દબાણ વિના કામ કરી શકે. આ વ્યવસ્થા અમેરીકામાં ૧૮૦૦માં થઈ. અમેરીકાની પોલીસમાં કેમ નહીંવત ભ્રષ્ટાચાર છે? એકમાત્ર કારણ છે - ત્યાં નાગરીકો પાસે પોલીસ ચીફ, ન્યાયાધીશ, સરકારી વકીલ, મુખ્યમંત્રી બદલવાની પ્રોસીજર છે. જયપ્રકાશ નારાયણે આ માંગણી કરેલ. ૧૯૭૭માં જનતા પાર્ટીના જે દોષણાપત્રથી વાજપાઈ, અડવાણી મંત્રી થયા તેમાં રિકોલની ખાત્રી હતી. ભારતની અનેક સમસ્યાઓનું મૂળ છે: નાગરીકો નેતા, અધિકારી, ન્યાયાધીશોને નથી બદલી શકતા દા. ત. -- (૧) ૨૦૦૮માં છ મહીના જમ્મુ બંધ રહ્યું કેમકે અમરનાથ મંદીરને આપેલ જમીન જુટવી લીધી. જમીન જુટવાની મજાલ કેમ કરી? કેમકે ભારતનાં નાગરીકો પાસે પ્રધાનમંત્રીને કાઢી મુકવાની પ્રોસીજર નથી (૨) આશાચામનાં આશ્રમના બે બાળકોની હત્યામાં થઈ. શીલજમાં એક કાર ચાલકે ૩ વ્યક્તિઓને મારી નાખેલ. કેમ પોલીસે ભીનું સંકેત્યું? કેમકે નાગરીકો પાસે પોલિસ કમિશનરની બદલવાની કે બદલી અટકાવાની સત્તા નથી (૩) આપણા સાંસદે જિન્હાના વખાણ કરવાનું દુઃસાહસ કેમ કર્યું? કેમકે નાગરીકો પાસે સાંસદ બદલવાની સત્તા નથી. -- ગરજ સરી કે વેરી. ચુંટણી પતે એટલે તરતજ કેમ મંત્રી નાગરીકોનો દુશ્મન અને પૈસાદારોનો મિત્ર બને છે? કેમકે નાગરીકો પાસે તેને બદલવાની સત્તા નથી. હું એકમાત્ર ઉમેદવાર છું, જેણે નાગરીકો પ્રધાનમંત્રી, પોલિસચીફ, જજો બદલી શકે તેવી પ્રોસીજરોનો લખાણ આપ્યા છે. મતદારો તમામ ઉમેદવારોને પુછે કે તેઓ રિકોલના ટેકેદાર છે કે વિરોધી? રિકોલ વિરોધીને મત આપવો તે પાંચ વર્ષની ગુલામી માંગવા સમાન છે. રિકોલ વિરોધી નેતાને મત ન આપવો.
- ૩. નાગરીકોને રાશન દુકાન, ગેસ એજન્સી બદલવાની છુટ આપવી.** આપને રાશન દુકાન બદલવાની સત્તા મળશે, તો દુકાનદાર ઘરે ૧૦ લીટર કેરોસીન આપી જશે. કલાકો લાઇનમાં માત્ર ૭ લીટર મળે છે, તે હાડમારીનો અંત આવશે. આપને ગેસ એજન્સી બદલવાની સત્તા મળશે, તો એજન્સી ૨૧ દિવસ પછી સામેથી ફોન કરી બાટલો આપી જશે. અને ત્રણ કીલો રાંધણગેસના બાટલા પણ આપવા જેથી જે ગરીબ પાસે સામટા રૂ ૩૨૦ ન હોય, તેને પણ પોસાય.
- ૪. નાગરીક કલેક્ટરની કચેરીએ ભ્રષ્ટાચાર વિરોધી એફીડેવીટ આપેતો તેને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીના વેબસાઇટ પર મુકવી.** નાગરીકને આ એફીડેવીટો પર રૂ ૩ આપી હા-ના નોંધાવા દેવી. નાગરીકોની હા-ના ને પણ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીના વેબસાઇટ પર મુકવી.
- ૫. ગરીબ પછાતોના ટેકાથી સિવિલિયન ઘટાડવું :** પછાતોને ચોઇસ આપવી- તેને વાર્ષિક રૂ ૬૦૦ જોઇએ છે કે સિવિલિયન? ૯૦% ટકા પછાતો આર્થિક સહાય લેશે. આથી સિવિલિયન ૫૦%થી ઘટી ૫% થશે.
- ૬. સરકાર, અદાલતોમાં ભર્તી લેખિત પરીક્ષાઓથી કરવી.** ઇન્ટરવ્યુ પ્રથા રદ કરવી, જેથી સગાવાદ, ભ્રષ્ટાચાર ઘટે.
- ૭. નાગરીકો સીધા જ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીને નિમી શકે અને બદલી પણ શકે તેવી પ્રોસીજરો બનાવવી.** સાંસદોને પ્રધાનમંત્રીનાં ચુંટવા સત્તા આપવાથી સાંસદોમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. જો આપ મને સાંસદ બનાવશો, તો હું પ્રધાનમંત્રીનું ચયન અમદાવાદનાં નાગરીકોનો પ્રત્યક્ષ મત લઈ કરીશ. અને તમામ સાંસદોને પણ આમ કરવા કહીશ. નાગરીકોએ જાતે પ્રધાનમંત્રીની નિમાણુંક કરવી જોઇએ. આથી સાંસદોનો ભ્રષ્ટાચાર ઘટશે.
- ૮. જજ-પ્રથા નાબુદ કરી જ્યુરી-પ્રથા લાવવી,** જેથી અદાલતોમાં સગાવાદ, જ્ઞાતિવાદ અને સાંઠગાંઠ ઘટે
- ૯. ૪૯૮(ક) કલમ રદ કરવી.** આમા માત્ર વકીલો કમાણા છે અને અનેક નિર્દોષો જેલમાં સબડ્યા છે.
- ૧૦. ત્રાસવાદ ઘટાડવો :** પાકિસ્તાન કેમ ભારતમાં ત્રાસવાદીઓ મોકલે છે? શુ મેકસીકોની હિંમત છે કે અમેરીકામાં ત્રાસવાદીઓ મોકલે? ના, કેમકે અમેરીકાની સેના મજબુત છે. આપણી સેના મજબુત થશે, એટલે પાકિસ્તાનની સરકાર પણ ત્રાસવાદીઓ મોકલવાનું બંધ કરશે.

અન્ય ૭૦ કાયદાઓની વિગત <http://rahulmehta.com> પર આપેલ છે. અમોને મત ન આપો, તો આપની ઇચ્છા. પણ અમારી સહુ મતદારોને વિનંતી છે કે આપ ભેગા થઈ તમામ પાર્ટીનાં કાર્યકરોને કહો કે તેઓ ઉપર સુચવેલ કાયદાઓ તેમની પાર્ટીના ઉમેદવારો પાસે મંજૂર કરાવે. આપ મતદારો ચેનલવાળાઓ કહોકે રિકોલ વગેરે મુદ્દા પર ઉમેદવારોની ચર્ચા રાખે. - જય હિન્દ, વન્દે માતરમ

શુ આપને ભારતમાં રાઈટ ટુ રિકોલ જોઇએ છે?

તો અમારી સાથે જોડાવા આગળ આવો અને બેટરીનું નિશાન યાદ રાખજો

સંપર્ક : એફ-૧/એ, સુપથ-૨, જુનાવાડજ બસસ્ટેન્ડ, ૮૮૨૫૧-૨૭૭૮૦, MehtaRahulC@yahoo.com

આ એડ જાહેરમાં વાંચી, પ્રચાર કરવો. ઝેરોક્ષ સહુને આપવી. આને દરવાજે ચોંટાડાવી, મતદાનના દિવસે યાદ રહે